

Seat No. \_\_\_\_\_

[47] E

SARDAR PATEL UNIVERSITY

No. of Printed Pages 3

B. Sc. ( Semester-III) EXAMINATION  
US03CCHE01 (Organic Chemistry)

Date: 15-6-2022

Time : 12:00 PM- 02:00 PM

Total Marks : 70

Note: (i) All questions are to be attempted. (ii) Figures to the right indicate marks.

Choose the correct option for the following: [10]

Q.1

- (1) How many structural isomer are possible for  $C_4H_9Br$ ?  
(a) 2      (b) 3      (c) 4      (d) 5
- (2)  $10 \text{ cm} = \dots \text{dm}$   
(a) 1      (b) 0.1      (c) 100      (d) 1000
- (3) Which of the following compounds exhibit geometrical isomerism  
(a) 1-pentene      (b) 2-methyl-2-pentene      (c) 2-penten  
(d) 2-methyl-2-butene
- (4) Optical isomerism is shown by ?  
(a) n-butyl chloride      (b) sec-butyl chloride  
(c) tert-butyl chloride      (d) iso--butyl chloride
- (5) Which of the following reagent will react readily with both aldehyde and ketone?  
(a) Grignard reagent      (b) Schiff's reagent      (c) Tollen's reagent  
(d) Fehling's reagent
- (6) In manufacture of dynamite one of the chemicals used is.....  
(a) Glycerol      (b) Glycerol tri acetate  
(c) Glycerol tri iodide      (d) Glycerol tri nitrate
- (7) The correct b.p. order of (i) tert-butyl alcohol      (ii) ethyl alcohol (iii) water  
(a) i > ii > iii      (b) iii > ii > i      (c) ii > iii > i      (d) iii > i > ii
- (8) Which of the following is a secondary amine  
(a)  $CH_3CH(NH_2)CH_3$       (b)  $CH_3CH_2NHCH_3$       (c)  $NH_2CH_2CH_2NH_2$   
(d)  $(CH_3)_3N$
- (9) Which of the following is not carboxylic acid.  
(a) Picric acid      (b) Acetic acid  
(c) Adipic acid      (d) Malonic acid
- (10) Which of the following reaction is suitable for the synthesis of salicyladehyde?  
(a) Kolbe reaction      (b) Reimer-Tiemer reaction      (c) Gatterman reaction  
(d) Claisen condensation

[08]

Q-2 Give the following statements are True or False (One marks each) :

- (1) Enantiomers are superimpossible on their mirror images .
- (2) Lactic acid is optically active compounds
- (3) The Hell-Volhard Zelinsky reaction for  $\beta$ -halo acid
- (4) Reduction of aldehyde always gives 1° alcohol.
- (5) Benzaldehyde undergoes aldol condensation.
- (6) Phenols are more acidic than carboxylic acid.
- (7) Acetophenone does not give iodoform test.
- (8) Hydroboration - oxidation of propene gives n-propyl alcohol .

[20]

Q-3 Answer the following (Attempt any ten)

- (1) Eclipsed confirmation of ethane is less stable than staggered confirmation -  
Explain.
- (2) Define the terms: Enantiomers and Diastereomers.
- (3) Ethanol undergoes oxidation reaction easily, but tertiary-butyl alcohol does not,  
Explain.
- (4) Tert-butyl chloride upon reaction with alkoxide gives elimination product and  
not substitution, Explain.
- (5) Write a note on base-catalyzed cleavage of epoxides
- (6) Aldehyde generally undergoes nucleophilic addition more readily than  
ketone , Explain.
- (7) Define: iodoform test with illustration.
- (8) Acetoacetic ester is a much stronger acid than ordinary esters, Explain
- (9) Define Kolbe reaction with illustration.
- (10) Explain  $\alpha$ -chloro butyric acid is stronger acid than  $\beta$ -chloro butyric acid.
- (11) Carboxylic acid has higher boiling point than alcohol - Explain.
- (12) O-nitro phenol is less volatile than p-nitro phenol - Explain.

[32]

**Q-4 Long Answer the following (Attempt any four)**

- (1) Define "confirmation" Draw all Newman formula of confirmation of n-butane and explain their stability with potential energy diagram and arrange them into increasing order stability.
- (2) State and explain the sequence rules of R & S configuration with suitable examples. Draw all possible conformational isomers & cyclohexane and arrange them into stability order.
- (3) Write the synthesis of glycerol from propene via halo hydrin formation and give the detail stepwise reaction mechanism of Pinacol – Pinacolone rearrangement
- (4) Give the detail stepwise reaction mechanism of acid - catalyzed cleavage of epoxide and Draw structure of all isomeric alcohol having molecular formula  $C_4H_{10}O$  and write IUPAC name and classify them 1°, 2° and 3° alcohol.
- (5) Explain aldol condensation mechanism of acetone and give stepwise detail mechanism of Wittig reaction.
- (6) Give a brief account on "Hinsberg's " test and Draw the structure of all isomeric amine having formula  $C_4H_{11}N$ , class them 1°, 2° and 3° amine and write IUPAC name.
- (7) Give reaction mechanism of Gatterman synthesis.
- (8) Phenol is stronger acid than alcohol – explain and Give the synthesis of  $\alpha$  - methyl valeric acid.

(3)



Seat No. \_\_\_\_\_

No. of Printed Pages: 3

[47] 6

## SARDAR PATEL UNIVERSITY

B. Sc. (Semester-III) EXAMINATION  
US03CCHE01 (Organic Chemistry)

Date: 13-6-2022

Time : 12:00 PM-02:00 PM

Total Marks : 70

Note: (i) All questions are to be attempted. (ii) Figures to the right indicate marks.

Q.1 યોગ્ય વિકલ્પ પસંદ કરો (દરેકના એક ગુણા) [10]

(1)  $C_4H_9Br$  સુત્રના શક્ય બધારણીય સમઘટકો કેટલા ?

- (a) 2 (b) 3 (c) 4 (d) 5

(2) 10 cm = .....dm

- (a) 1 (b) 0.1 (c) 100 (d) 1000

(3) નીચેના પૈકી ક્યો કે જે ભૌમિકિક સમઘટકટા ધરાવે છે?

- (a) 1-પેન્ટીન (b) 2-મિથાઇલ-2-પેન્ટીન  
(c) 2-પેન્ટીન (d) 2-મિથાઇલ -2-બ્યુટીન

(4) નીચેના પૈકી ક્યો કે જે ઓપ્ટીકલ(પ્રકાશીય) સમઘટકતા ધરાવે છે?

- (a) n-બ્યુટાઇલ કલોરાઇડ (b) sec- બ્યુટાઇલ કલોરાઇડ  
(c) tert-બ્યુટાઇલ કલોરાઇડ (d) iso- બ્યુટાઇલ કલોરાઇડ

(5) નીચેના પૈકી ક્યો પ્રક્રિયક આલ્ડિહાઇડ અને કીટોન બજે સાથે સરળતા પ્રક્રિયા કરે છે?

- (a) ગ્રુઝાઈડ પ્રક્રિયક (b) સ્કીફ પ્રક્રિયક (Schiff's reagent)  
(c) ટોલેન્સ પ્રક્રિયક (d) ફેહલીન પ્રક્રિયક (Fehling's)

(6) ડાઇનેમાઇટ ની બનાવટ ક્યો રસાયણ વપરાય છે?

- (a) ક્લિસરોલ (b) ક્લિમરોલ દ્રાય એસિટેટ  
(c) ક્લિસરોલ દ્રાય આયોડાઇડ (d) ક્લિસરોલ દ્રાય નાઇટ્રેટ

(7) (i) tert- બ્યુટાઇલ આલ્કોહોલ , (ii) ઇથાઇલ આલ્કોહોલ  
(iii) પાણી માટેનો ઉ.બિ.નો સાચો કમ આપો

(a) i > ii > iii (b) iii > ii > i (c) ii > iii > i (d) iii > i > ii  
(8) નીચેના પૈકી ક્યો દિતિયક એમાઇન છે ?

- (a)  $CH_3CH(NH_2)CH_3$  (b)  $CH_3CH_2NHCH_3$   
(c)  $NH_2CH_2CH_2NH_2$  (d)  $(CH_3)_3N$

(9) નીચેના પૈકી ક્યો એસિડ કાર્બોક્સીક સમુહ ધરાવતો નથી

- (a) પિટ્ક એસિડ (b) એસિટિક એસિડ  
(c) એડિપિક એસિડ (d) મેલોનિક એસિડ

(10) નીચેના પૈકી કૃત પ્રક્રિયાથી સેલિસિલાલ્ડિહાઇડ બને છે?

(a) કોલ્બે પ્રક્રિયા (b) રિમર-ટિમર પ્રક્રિયા

(c) ગેટરમેન પ્રક્રિયા (d) કલેસન સધનન પ્રક્રિયા

Q - 2 નીચે આપેલ વિધાનો ખરા કે ખોટા તે જણાવો(દરેકના એક [08]

ગુણ)

(1) જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપીત થઈ શકતા હોઈ તેવા અવકાશીય સમઘટકોને છનેન્શ્યોમર કહે છે

(2) લેકટિક એસિડ એ પ્રકાશ કિયાશીલ છે.

(3) ફેલ વોલ્હાર્ડ અલિસ્કાય પ્રક્રિયા એ ડા-ફેલો એસિડ માટેની પ્રક્રિયા છે.

(4) આલ્ડીહાઇડના રિડક્ષનથી 1'-આલ્કોહોલ મળે છે. .

(5) બેન્જાલ્ડીહાઇડ એ આલ્કોલ સધનન પ્રક્રિયા આપે છે.

(6) ફીનોલની એસિડીકતા કાર્બોક્યુલીટીક એસિડ કરતાવધુ છે.

(7) એસિટોફીનોન આયોડોફ્રોર્મ કસોટી આપતો નથી.

(8) પ્રોપિનનું હાઇડ્રોબોરેશન-ઓકિસડેશન પ્રક્રિયાથી n-પ્રોપાઇલ આલ્કોહોલ મળે છે.

Q-3 નીચેનાંના જવાબ આપો (ગમે તે દસ) [20]

(1) છથેનના ઇકલીપ્સ સંરૂપણ જે સ્ટેગાર્ડ સંરૂપણ કરતાં ઓછુ સ્થાયી છે-સમજાવો.

(2) વ્યાખ્યા આપો : છનેન્શ્યોમર અને ડાયાસ્ટીરીયોમર

(3) છથેનોલનું ઓકિસડેશન સહેલાઈ થી થાય છે જ્યારે તૂતીયક બયુટાઇલ આલ્કોહોલનું મુશ્કેલીથી થાય છે-સમજાવો..

(4) તૂતીયક બ્યુટાઇલ કલોરાઇડની આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી વિલોપીત નીપજ મળે છે પરંતુ વિસ્થાપીત નીપજ મળતી નથી-સમજાવો.

(5) ઇપોક્સાઇડમાં બેઇઝ-ઉદીપકીય વિભાજન પ્રક્રિયાપર નોંધ લખો.

(6) ફેન્સાનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ કિટોનની સરખામણીમા સરળતાથી થાય છે -સમજાવો.

(7) વ્યાખ્યા આપો : આયોડોફ્રોર્મ કસોટી(ઉદાહરણ સહિત)

(8) સામાન્ય એસ્ટરની સરખામણીમા એસિટોએસિટિક એસ્ટરની એસિડિક પ્રબળતા વધુ છે-સમજાવો.

(9) વ્યાખ્યા આપો : કોલબે પ્રક્રિયા(ઉદાહરણ સહિત)

- (10) સમજવો:  $\alpha$ -કલોરો બ્યુટીરીક એસિડ એ  $\beta$ -કલોરો બ્યુટીરીક એસિડ કરતા પ્રભળ એસિડ છે.
- (11) કાર્બોકાર્બોલિક એસિડ નું ઉ.બિ. આલ્ફોહોલ કરતા ઉચુ છે- સમજવો.
- (12)  $p$ - નાઇટ્રો ફિનોલ કરતા  $O$ -નાઇટ્રો ફિનોલની બાધ્યશીલતા ઓછી છે. સમજવો.

**Q-4**

**નીચેનાના Long Answer આપો (ગમે તે ચાર)**

[32]

- (1) સંરૂપણ(કન્ફરમર)ની વ્યાખ્યા આપો.  $n$ -બ્યુટેનના બધા સંરૂપણો ન્યૂમેન સુત્રો દોરો. તેના નામ જણાવી, પોટેન્શીયલ ઊર્જા આદેખ તેમજ તેમને સ્થાયિત્વના ચઢતાકમમાં ગોઈવી સમજવો.
- (2) R & S વિન્યાસ માટે કમનો નિયમ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજવો તેમજ સાયક્લો હેક્ટેનના શક્ય બધા સંરૂપણો આપો તેમને સ્થાયિત્વના કમમાં ગોઈવી સમજવો.
- (3) પ્રોપિનમાંથી ક્લિસરોલનું સંશેષણ હેલો-હાઇડ્રીન પદ્ધતિ વડે લખો. અને પિનાકોલ- પિનાકોલોન પુનઃરચનાની કિયાવિધી તબક્કાવાર આપો.
- (4) એસિડ ઉદ્દીપક આધારિત છપોકસાઇડનાં ખંડનની કિયાવિધી તબક્કાવાર આપો તેમજ  $C_4H_{10}O$  અણુસૂત્ર ધરાવતા આલ્ફોહોલના બધા સમઘટકોના. બંધારણો લખો, તેમનું IUPAC નામ આપો અને તેમને  $1^\circ, 2^\circ, 3^\circ$  આલ્ફોહોલમાં વર્ગીકરણ કરો
- (5) એસિટોનની આલોલ સંધનન પ્રક્રિયાની કિયાવિધી સમજવો. તેમજ વીટીગા પ્રક્રિયા(Witting reaction) ની તબક્કાવાર કિયાવિધી આપો.
- (6) હિન્સબર્ગ ક્સોટી સાવિસ્તાર સમજવો તેમજ  $C_4H_{11}N$  અણુસૂત્રના સમઘટકિય એમાઇનના બધા બંધારણો દોરો, તેમનું IUPAC નામ આપો અને તેમને  $1^\circ, 2^\circ, 3^\circ$  એમાઇનમાં વર્ગીકૃત કરો.
- (7) ગેટરમેન સંશેષણની તબક્કાવાર કિયાવિધી આપો.
- (8) સમજવો: ફિનોલ, આલ્ફોહોલની સરખામણીમાં પ્રભળ એસિડ છે. તેમજ  $\alpha$ -મિથાઇલ વેલેરીક એસિડનું સંશેષણ આપો

